

અંતરશુદ્ધિનાં સોપાન
શ્રીગુરુમાઈ દ્વારા લિખિત પુસ્તકમાંથી
ઉદ્ધરણ ૧૭

ભટકવું એ મનની સ્વાભાવિક વૃત્તિ છે. તેમ છતાં, જિજ્ઞાસુએ આના પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ, અને પોતાના મન અને હૃદયને ફરી સાચા માર્ગ પર લાવતા રહેવું જોઈએ.



© ૨૦૨૨ એસ.વાય.ડી.એ. ફાઉન્ડેશન®. સર્વાધિકાર સુરક્ષિત.

ગુરુમાઈ ચિદ્ધિલાસાનંદ, અંતરશુદ્ધિનાં સોપાન : દિવ્ય સદ્ગુણોનો યોગ, અધ્યાય ૧૧, ‘શુદ્ધ હૃદય’માંથી (ચિત્શક્તિ પબ્લિકેશન્સ, ચેન્નઈ, ૨૦૧૩),
પૃષ્ઠ ૧૫૭.